

પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને સરથાણા વિસ્તારમાં ચપ્પુની અણીએ કરેલ મોબાઈલ ફોનની લુંટના ગુનામાં મુદ્દામાલ સહિત ઝડપી પાડતી, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ.

સુરત શહેર વિસ્તારમાં મિલકત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ પો.સ.ઈ.એસ.પી.ઝાલા તથા તેમની ટીમના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન HC હિતેન્દ્રસિંહ ભુપતસિંહ તથા પો.કો. વિક્રમસિંહ મનુભા નાઓને મળેલ બાતમી આધારે ક્રાઈમ પો.સ.ઈ.શ્રી.એસ.પી.ઝાલા તથા તેમની ટીમના માણસો વરાછા ભરતનગર શાક માર્કેટ પાસેથી આરોપી (૧) સાગર ઉર્ફે ઘોડા બાબુભાઈ ભાલીયા ઉ.વ.૨૧ રહે.રામવાડી ફાર્મ હાઉસ ખોલવડ ગામ ભાદા રોડ તા-કામરેજ જી-સુરત મુળ વતન ગીર ગઢડા મામલતદાર કચેરીની બાજુમાં હી-ગીર સોમનાથ (૨) ભરત ઉર્ફે મોઠા જેઠાભાઈ ગોહિલ ઉ.વ.૨૧ રહે.ખાતા નં.૩૫ પહેલા માળે વિકલનગર સોસા., માતાવાડી વરાછા, સુરત મુળવતન :-ગામ મોઠા તા-ઉના જી-ગીર સોમનાથ નાઓને OPPO 2F મોડલનો મો.ફોન નં-૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા લુંટ કરવામાં વચરાયેલ ચપ્પુ સાથે ઝડપી પાડેલ સદર આરોપીઓની પુછપરછ દરમ્યાન તા:-૫/૧૧/૧૯ ના રોજ રાત્રીના અગ્યારેક વાગ્યાના સુમારે તેઓ પોતાના મિત્ર પિયુષ ઉર્ફે પાંચીયા સાથે યામાહા FZ મો.સા.ઉપર નીકળેલા અને સરથાણા શાયોના પ્લાઝા પાસેથી પસાર થતી વખતે ત્રણ ઈસમોને આંતરીને તેમને જણાવેલ કે તમે મારી બહેનને કેમ મેસેજ કરો છો તેમ કહી એક ઈસમે ચપ્પુ વડે ઈજાઓ પહોંચાડી OPPO 2F કંપનીનો મોબાઈલ ફોન લઈ તેમની સાથે ઝપાઝપી કરી નાશી ગયેલની હકિકત જણાવેલ છે જે બાબતે સરથાણા પો.સ્ટે. 1 ગુ.ર.નં.૪૫૮/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરેલ છે. તેમજ સદર આરોપી સાગર ઉર્ફે ઘોડા બાબુભાઈ ભાલીયાની વધુ પુછપરછ કરતા પોતે આજથી આશરે એકાદ વર્ષ પહેલા પોતાના મિત્રો સાથે મળીને પાલીતાણા બજરંગદાસ પોલીસ ચોકી પાસે પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સાથે છરી તથા પાઈપ તથા ગુપ્તી જેવા હથિયારો વડે મારામારી કરી સોનાની ચેઈન કિ.રૂ. ૩૫,૦૦૦/- તથા રોકડા રૂ. ૪૦૦૦/- ની લુંટ કરેલ જે પાલીતાણા પો.સ્ટે. 1 ગુ.ર.નં-૭૯/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬(૨)૩૨૩ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે ગુન્હામાં આરોપી નાસતો ફરતો હોય જે ગુન્હો વણ શોધાયેલ હોય જે ગુન્હાઓનો ભેદ ઉકેલી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

આરોપીનો ગુનાહીત ઈતિહાસ :- આરોપી સાગર ઉર્ફે ઘોડા બાબુભાઈ ભાલીયા આગાઉ સને-૨૦૧૬ તથા સને ૨૦૧૭ માં વરાછા પો.સ્ટે. મા મોબાઈલ સ્નેચીંગના ગુન્હામાં તથા સને -૨૦૧૮ માં મારામારીના ગુનામાં કાપોદ્રા પો.સ્ટે. માં પકડાયેલ છે.